https://archive.org/details/bk1143/page/n0/mode/1up

2022-04-12 -Letter from Satpanthi to Confuse, Divide and Instill Fear amongst Sanatanis (1143)

All Items on https://archive.org/details/realpatidar

ગણેશાય નમઃ ॥   ॥ શ્રી લક્ષ્મી નારાયણે નમઃ ॥   ॥ શ્રી ઉમીયાયે નમઃ ॥

તા. ૧૨-૪-૨૨

શ્રી અખીલ કચ્છ કડવા પાટીદાર સમાજ, યુવાસંગ નેએ મહિલા મંડળ, નખત્રાણા, કચ્છ.
લોનાવલાથી મુંબઈ નાસિકને પુનાના, કચ્છ ચેતના ગ્રુપના પ્રણામ.

Full Library on https://realpatidar.com/library

જય શ્રી લક્ષ્મી નારાયણ સાથે લખવાનું કે, આપણી અખીલ કચ્છ કડવા પાટીદાર સમાજમાં, સનાતન તથા સમાજો વચે જે, ધર્મના નામે વાદ વિવાહ ચાલી રહ્યા છે. એ દુરભાગ્યની વાત છે. પરંતુ સતપંથી ધર્મ અથર્વવેદ સનાતન ધર્મના આધારે બનેલો છે. તેથી તે બહ્મા વિષ્ણું મહેશ આદ શક્તિ, અને આદ નારાયણ શ્રી કલકી ભગવાનને સતપંથી પુજી રહ્યા છે. સમય બળવાન છે. એક દિવસ ભલે સંતપંથમાં ભેળસેળ કદાચ હશે, પણ આજે એ ભેળસેળ નીકળી સતપંથમાં ચોખું હિન્દુત્વ છે. છતાં પણ કચ્છ કડવા પાટીદારમાંથી, સતપંથનો ૧૦૦ ટકા સફાયો સનાતન સમાજ કરવા માગે છે. પરંતુ સતપંથ તો આદ નારાયણના રૂપમાં સબરીની જેમ, શ્રી કલકી પ્રભુનું સિયાસન અને શ્રી લક્ષ્મીજીના રૂપમાં ઘીની અખંડ જ્યોતીને પુજી, સતપંથી તો શ્રી લક્ષ્મી નારાયણને જ પુજી રહ્યા છે. એ કલકી નકલંકી ને નિષ્કલંકી એક જ છે. તે વેદ આધારે યોગ્ય છે. તેથી તેમનાં મંદિરો બંધ કરવાં યોગ્ય નથી. તો જુઓ સમાજમાં જેનાં જેનાં વડીલોએ, સતપંથીની નીંદા કરી છે. તેમની પ્રજા આજે ગમે તે રીતે નીંદાની સજા ભોગવી રહી છે. એક એકનું તો ખાધાવાળું પણ રહ્યું નથી. કારણ પાપ કોઈને છોડતું નથી. વેદ આધારે શ્રી કલકી પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણનો જ અતાર છે. તેથી કલકી પ્રભુ આજે સ્વર્ગ મૃત્યુને પાતાળના કર્તા નારાયણ હોઈ, એને પુજવા યોગ્ય છે. તેનો વિરોધ કરવો એ મુશીબતોને આમંત્રણ આપવા જેવું છે. તો મહાભારતને રામાયણ પહેલી લખાણી હતી ને પછી ભજવાઈ. તેમ કલીયુગનીં ગાથા વેદ આધારે સતપંથમાં પહેલી લખાણીંછે. ને હવે ભજવાય છે સમજો.

સમય વરતંતે સાવધાન, ઈતિહાસ જુઓ યુગે યુગે જેને અવતાર પાત્રને પુજ્યા છે. તે જીવોનો ઉધાર થયો છે. ત્યારે રાવણ કૌરવો અને કંસે ભગવાન શ્રી વિષ્ણુનારાયણનો વિરોધ કર્યો. તેથી તેમના કુળોનો જ નાશ થયો. કલીયુગના પ્રલય દિવસો હવે બહુ દુર નહિં હોય. કારણ આજે દુનિયા જુઠ અનિંતી અન્યાય ને અહંકારથી જ જીવી રહી છે. તેથી ધર્મ તો પુરેપુરો ખંડીત થઈ ચુક્યો છે. માટે જ નકલંકી પ્રભુને નાં છુટકે હવે પ્રગટ થવુંજ પડશે. જુઓ રાજસ્થાનમાં રામદેવ પીરનું ધર્મ, પંજાબમાં શીખ ધર્મ, કર્નાટકમાં લીંગાયત ધર્મ, યુપીમાં નકલંક ધર્મ, ઓરીસામાં સતપંથ ધર્મ, જેવોં અનેક ધર્મો એવાં છે કે, એ નકલંકી પ્રભુને જુદા જુદા નામે પુજે છે. ત્યારે સતપથમાં સદ ગુરૂએ વેદ આધારે ભાંખ્યુ છે કે , કલીયુગના અંન્તે દઈત કાળીંગો ચીનથી સેના લઈ, ગાંધીનગરને ટારગેટ બનાવી, પાટણ ને મહેસાણા પાસે પાવડી આરે આવી પહોંચશે. ત્યારે આદ નારાયણ વિષ્ણું ભગવાન નકલંકી રૂપે, જે આજે ગુપ્ત છે. તે જાહેર થઈ, દઈત કાળીંગાને મારશે. ત્યારે ધર્મનો જય જયકાર થશે. અને પાપનો ખે થશે. જુઓ સતપંથમાં સોકિયાની સદગુરૂ એ, શીક્ષાપાત્રની જનોઈ પાળવા કહ્યું છે. તે મુજબ સતપંથી ઓ સાર્વજનીક તથા ધર્મના નીતીનિયમો પાળે છે. અને ત્યારે સનાતન ધર્મમાં કોઈ પણ જાતનાં નિતી નિયમો નથી. સમાજમાં દારૂ પીવાય છે. અને નાં ખાવાનું બીન હિંન્દુ પકાવે છે, ને આપે ખાઈએ છીયે. તો પછી ક્યાં ગયો આપણો સનાતન ધર્મ, ને ક્યાં ગયું આપણું હિન્દુત્વ. તેથી જ દુઃખ અને મુસીબતો આવે છે. આજે અખીલ વિશ્વ હિંન્દુ પરિષદ, આર. એસ. એસ., બજરંગ દળે, અને અખીલ ભારતીય સાધુ સંત સમાજે તો, સતપંથ ધર્મમાં જગતગુરૂ અને મહામડળેશ્વરની સીટ આપી, સતપંથની સચાઈ સાબીત કરી દીધી છે. તો નકલંકી પ્રભુ જ્યારે પ્રગટ થશે, ત્યારે સનાતન સમાજને મહા મુશીબતો પણ આવી શકે એમ છે. અને જેને નકલંકી ભગવાનને આજે પુજ્યા હશે તેમના માટે સોનાનો દિવસ ઉગશે. એમ વેદ શાસ્ત્રો કહે છે. નકલકી વિષે અન્ય મહાત્માની આગમવાણીઓ : શ્રી તુલસીદાસ મહારાજની આગમવાણી : ભવ તારણ ભગવંત ભજ, ધારણા પર ધર ધ્યાન. એ ધારણા એજ આગમ, એક નકલકી નામઃ આજે ભવ સાગર તરવા નકલકીને ભજી લે. એના સમરંણથી ભવ સાગર તરાસે. એવું હું આગમ દેખું છું.

સંત પંથને સમજ્યુ છે.

નરસીંહ મહેતાની આગમવાણી : ઘોડલે ચડીને આવશે, આવશે મારા યુગોયુગનો સ્વામી : કલીયુગ ઉથાપી

realpatidar.com

https://archive.org/details/bk1143/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

realpatidar.com

॥ શ્રી ગણેશાય નમઃ ॥ ॥ શ્રી લક્ષ્મી નારાયણે નમઃ ॥ ॥ શ્રી ઉમીયાયે નમઃ ॥

તા. ૧૨-૪-૨૨

શ્રી અખીલ કચ્છ કડવા પાટીદાર સમાજ, યુવાસંગ નેએ મહિલા મંડળ, નખત્રાણા, કચ્છ.
લોનાવલાથી મુંબઈ નાસિકને પુનાના, કચ્છ ચેતના ગ્રુપના પ્રણામ.

જય શ્રી લક્ષ્મી નારાયણ સાથે લખવાનું કે, આપણી અખીલ કચ્છ કડવા પાટીદાર સમાજમાં, સનાતન તથા સતપંથ સમાજો વચે જે, ધર્મના નામે વાદ વિવાહ ચાલી રહ્યા છે. એ દુરભાગ્યની વાત છે. પરંતુ સતપંથી ધર્મ અથર્વવેદ અને સનાતન ધર્મના આધારે બનેલો છે. તેથી તે બ્રહ્મા વિષ્ણું મહેશ આદ શક્તિ, અને આદ નારાયણ શ્રી કલકી ભગવાનને સતપંથી પુજી રહ્યા છે. સમય બળવાન છે. એક દિવસ ભલે સંતપંથમાં ભેળસેળ કદાચ હશે, પણ આજે એ ભેળસેળ નીકળી સતપંથમાં ચોખું હિન્દુત્વ છે. છતાં પણ કચ્છ કડવા પાટીદારમાંથી, સતપંથનો ૧૦૦ ટકા સફાયો સનાતન સમાજ કરવા માગે છે. પરંતુ સતપંથ તો આદ નારાયણના રૂપમાં સબરીની જેમ, શ્રી કલકી પ્રભુનું સિયાસન અને શ્રી લક્ષ્મીજીના રૂપમાં ધીની અખંડ જ્યોતીને પુજી, સતપંથી તો શ્રી લક્ષ્મી નારાયણને જ પુજી રહ્યા છે. એ કલકી નકલંકી ને નિષ્કલંકી એક જ છે. તે વેદ આધારે યોગ્ય છે. તેથી તેમનાં મંદિરો બંધ કરવાં યોગ્ય નથી. તો જુઓ સમાજમાં જેનાં જેનાં વડીલોએ, સતપંથીની નીંદા કરી છે. તેમની પ્રજા આજે ગમે તે રીતે નીંદાની સજા ભોગવી રહી છે. એક એકનું તો ખાધાવાળું પણ રહ્યું નથી. કારણ પાપ કોઈને છોડતું નથી. વેદ આધારે શ્રી કલકી પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણનો જ અતાર છે. તેથી કલકી પ્રભુ આજે સ્વર્ગ મૃત્યુને પાતાળના કર્તા નારાયણ હોઈ, એને પુજવા યોગ્ય છે. તેનો વિરોધ કરવો એ મુશીબતોને આમંત્રણ આપવા જેવું છે. તો મહાભારતને રામાયણ પહેલી લખાણી હતી ને પછી ભજવાઈ. તેમ કલીયુગનીં ગાથા વેદ આધારે સતપંથમાં પહેલી લખાણીંછે. ને હવે ભજવાય છે સમજો.

સમય વરતંતે સાવધાન, ઈતિહાસ જુઓ યુગે યુગે જેને અવતાર પાત્રને પુજ્યા છે. તે જીવોનો ઉધાર થયો છે. ત્યારે રાવણ કૌરવો અને કંસે ભગવાન શ્રી વિષ્ણુનારાયણનો વિરોધ કર્યો. તેથી તેમના કુળોનો જ નાશ થયો. કલીયુગના પ્રલય દિવસો હવે બહુ દુર નહિં હોય. કારણ આજે દુનિયા જુઠ અનિંતી અન્યાય ને અહંકારથી જ જીવી રહી છે. તેથી ધર્મ તો પુરેપુરો ખંડીત થઈ ચુક્યો છે. માટે જ નકલંકી પ્રભુને નાં છુટકે હવે પ્રગટ થવુંજ પડશે. જુઓ રાજસ્થાનમાં રામદેવ પીરનું ધર્મ, પંજાબમાં શીખ ધર્મ, કર્નાટકમાં લીંગાયત ધર્મ, યુપીમાં નકલંક ધર્મ, ઓરીસામાં સતપંથ ધર્મ, જેવોં અનેક ધર્મો એવાં છે કે, એ નકલંકી પ્રભુને જુદા જુદા નામે પુજે છે. ત્યારે સતપથમાં સદ ગુરૂએ વેદ આધારે ભાંખ્યુ છે કે , કલીયુગના અંન્તે દઈત કાળીંગો ચીનથી સેના લઈ, ગાંધીનગરને ટારગેટ બનાવી, પાટણ ને મહેસાણા પાસે પાવડી આરે આવી પહોંચશે. ત્યારે આદ નારાયણ વિષ્ણું ભગવાન નકલંકી રૂપે, જે આજે ગુપ્ત છે. તે જાહેર થઈ, દઈત કાળીંગાને મારશે. ત્યારે ધર્મનો જય જયકાર થશે. અને પાપનો ખે થશે. જુઓ સતપંથમાં સોકિયાની સદગુરૂ એ, શીક્ષાપાત્રની જનોઈ પાળવા કહ્યું છે. તે મુજબ સતપંથી ઓ સાર્વજનીક તથા ધર્મના નીતીનિયમો પાળે છે. અને ત્યારે સનાતન ધર્મમાં કોઈ પણ જાતનાં નિતી નિયમો નથી. સમાજમાં દારૂ પીવાય છે. અને નાં ખાવાનું બીન હિંન્દુ પકાવે છે, ને આપે ખાઈએ છીયે. તો પછી ક્યાં ગયો આપણો સનાતન ધર્મ, ને ક્યાં ગયું આપણું હિન્દુત્વ. તેથી જ દુઃખ અને મુસીબતો આવે છે. આજે અખીલ વિશ્વ હિંન્દુ પરિષદ, આર. એસ. એસ., બજરંગ દળે, (સંત પંથને સમજ્યુ છે.) અને અખીલ ભારતીય સાધુ સંત સમાજે તો, સતપંથ ધર્મમાં જગતગુરૂ અને મહામડળેશ્વરની સીટ આપી, સતપંથની સચાઈ સાબીત કરી દીધી છે. તો નકલંકી પ્રભુ જ્યારે પ્રગટ થશે, ત્યારે સનાતન સમાજને મહા મુશીબતો પણ આવી શકે એમ છે. અને જેને નકલંકી ભગવાનને આજે પુજ્યા હશે તેમના માટે સોનાનો દિવસ ઉગશે. એમ વેદ શાસ્ત્રો કહે છે. નકલકી વિષે અન્ય મહાત્માની આગમવાણીઓ : શ્રી તુલસીદાસ મહારાજની આગમવાણી : ભવ તારણ ભગવંત ભજ, ધારણા પર ઘર ધ્યાન. એ ધારણા એજ આગમ, એક નકલકી નામઃ આજે ભવ સાગર તરવા નકલકીને ભજી લે. એના સમરંણથી ભવ સાગર તરાસે. એવું હું આગમ દેખું છું.

નરસીંહ મહેતાની આગમવાણી : ઘોડલે ચડીને આવશે, આવશે મારા યુગોયુગનો સ્વામી : કલીયુગ ઉથાપી

realpatidar.com

https://archive.org/details/bk1143/page/n3/mode/1up

realpatidar.com

સતયુગ સ્થાપશે, મહેતા નરસીંહનો સ્વામી : વેદવ્યાસે ભાગવતમાં કહ્યું છે કે. હનિષ્યંતી કલેરંતે, મલેચ્છા સ્તુરંગ વહાન. ધર્મ સ્થાપનાર્થાય, તસ્મે કલ્કા આત્માયે નમ:

ધર્મનીંહાનીં પછી તેના પુન સ્થાપન માટે, કલીયુગના અન્તે અશ્વરૂદ્ર થઈને, ધર્મની સ્થાપના કરશે. એવા નકલંકી પ્રભુને હું નમસ્કાર કરૂ છું. દેવાયત પંડીતની આગમવાણી.

યતી સતીને સાબરમતી, ત્યાં થાશે સુરાનાં સંગ્રામ, દઈત કાળીંગાને મારશે નકલંકી ધરશે નામ. અથર્વવેદમાં છે સાબરમતી પૂર્વ પ્રષ્ટે, ગીરમટે રેવા ઓતરંગે, સોડસ જોજરંગ, કલ્કાત્માય કાળીંગો સ્વાહ: – સાબરમતી પૂર્વે, ગીરમાટાથી ઉતરે : ચોસઠ ગાઉ પર, નકલંકી કાળીંગાને મારશે. રામદેવપીરની આગમવાણી.

કુંવારિકામાં માંડવો રચાશે, ને નકલંકીને પરણાવા. પાંચ સાત નવ બાર આવશે, માડવો સણગારવા વિષ્ણુ ભગવાન પાતાળમાં દઈત સંખાસુર પાસે વેદ લેવા ગયા, ત્યારે ધરતી માતાને વચન આપ્યું છે કે, કલીયુગના અંન્તે કુંવારિકાક્ષેત્રે, ધરતી માતાને પરણસે. ત્યાં તેત્રીસ કરોડ દેવો માંડવો સણગારશે.

આજે દઈત કાળીંગાનું સ્થાનક ચીંન છે. ચીંન ભારતની વેદિક હિન્દુ સનાતન સંસ્કૃતીનો નાશ કરી, ભારતમાં રાજ કરવા માગે છે. ચીંન આજે દુનિયામાં ૯૦ દેશોને કર્જ આપી રાજ ચલાવે છે. છતાં પણ નિષ્કલંકી પ્રભુ કાળીંગાને મારી, દુનિયામાં રામ રાજ્ય સ્થાપશે. એમ શાસ્ત્રો કહે છે. અને કહે છે કે : પ્રલય દિવસમાં ચાંદો સુરજ નીંચા આવશે, ત્યારે ધરતી તાબાં વરણી થાશે. ત્યારે દુ:ખ થશે બહુ ભારી, ત્યાં નથી કોઈ છટકવાનીબારી. નિષ્કલંકી જ્યારે કરશે અસવારી, ત્યારે ત્રણે ભુવનો જશે કંપી. ફરસુરામનીં હતી ફરસી, શ્રી કૃષ્ણ હતા ચક્રધારી નિષ્કલંકી હાથમાં ખડું ધરી, દઈતો સહારશે એ ખંડાથી. એક સંતે કહ્યું છે કે : નીંદક મીલોતોમત મીલો, અન્ય પાપી મીલો ભલે હજાર. વો નિંદક કે શીર પર, લાખ પાપકા હે ભાર. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, જ્યારે જ્યારે ધર્મનીં હાની, અને અધર્મની વૃદ્ધી થાય છે. ત્યારે હું અવતાર ધારણ કરૂં છું. તો નર નારાયણ શ્રી વિષ્ણું ભગવાને નવ અવતારોમાં, નવ દંઈતોને સહારી ને ભક્તો ઓધાર્યા છે. અને હવે ત્રીલોકનો નાથ શ્રી નિષ્કલંકી નારાયણ દશમેં રૂપે દંઈતો સહારી, ભક્તો ઓધારી, સતયુગ સ્થાપી, રામ રાજ સ્થાપશે, એમ વેદો ને શાસ્ત્રો કહે છે. સમાજનાંસોમીહા બાપા પ્રમુખ બન્યા. ત્યારથી સમાજમાં અંધાધુંધી ફેલાવી ને, પોતાનો જીવ ગુમાવ્યો, રાવણનો દિ ઉઠ્યો ત્યારે સીતાનું હરણ કયું. કશનો દિઉઠ્યો ત્યારે શ્રી કૃષ્ણનો વિરોધી બન્યો. તેવીરીતે સનાતન સમાજનો પણ આજેદિ ઉઠનાર છે. એવું લાગે છે. કારણ માંનવતા મુકી, ખોટા નિયમો બનાવી સંતપંથીને મજબુર કરી, સંતપંથ ધર્મ છોડાવી, આદ નારાયણ શ્રી કલકી પ્રભુનાં મંદિરો બંધ કરાવી સનાતન સમાજ પાપ વોરી રહી છે સમજો. જુઓ ધર્મ ખાતર ભીભીષણે પોતાના ભાઈ રાવણને છોડી શ્રી રામચંદ્રજીને સરણે ગયા હતા. તેવીજ રીતે આજે સતપંથી પણ કર્તા નારાયણ શ્રી કલકી પ્રભુને જ પુજી રહ્યા છે. આધ્યામિક માર્ગમાં નવઅવતારો વેદ આધારે થઈ ચુક્યા છે. અને હવે દશમા રૂપે કલકીપ્રભુ પ્રગટ થશે, ત્યારે કર્મોનો હિસાબ આપતાં, જીવોને બહુ ભારી દુ:ખ થાશે. માટે ખોટાં કર્ત્વય છોડજો. ખોટા કર્ત્વય રાજા રામના બાપને પણ છોડ્યા નથી તો ચેતાય તો ચેતજો, એજ વિનંતી. ટપાલમાં વધુ પડતું લખાઈ ગયું હોય તો ક્ષમા યાચના ૐ શાંન્તીશાંન્તી શાંન્તી.

લી. લોનાવલાથી કચ્છ ચેતના ગ્રુપના જય શ્રી લક્ષ્મી નારાયણ. ૐ નમો શ્રી કલકીનારાયણ નમો નમ:

આ ટપાલ સમાજના હિતમાં છે તેથી દરેક સતપથી ભાઈઓને સમાજની સંગા સબંધી ને મિત્રોમાં ઝેરોક્ષ કે મોબાઈલથી ચાર કે ચાર જણને આ ટપાલ પહોંચાડવા કૃપા કરશો

realpatidar.com